

L.L.B. Semester - 3 (CBCS) Examination
Oct/Nov. – 2019 (Old Course)
PRINCIPLES OF TAXATION LAW (CORE)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-૧ આવકવેરા કાયદા નીચે મકાન મિલકતની આવક એટલે શું? મકાન મિલકતની આવક નીચે બાદ (૧૪)
 મળતા ખર્ચાઓ વર્ણવો..

અથવા

પ્રશ્ન-૧ મૂડી નફો સમજાવી મૂડી મિલકત, તેની ગણતરીની રીતો અને કઈ બાબતો વેરા મુક્તી પાત્ર છે તે સમજાવો.

પ્રશ્ન-૨ આકારણી વર્ષ, નાણાકીય વર્ષ અને પાછલું વર્ષ ઉદાહરણ સહિત સમજાવો. (૧૪)

અથવા

પ્રશ્ન-૨ પગારની આવક સમજાવી વિવિધ સ્તરે બાદ મળતા ખર્ચ વર્ણવી નેટ આવક ઉદાહરણ સહિત સમજાવો.

પ્રશ્ન-૩ વેટના (મૂલ્ય વર્ધિત વેરા) ના કાયદા નીચે અમુક કિસ્સાઓમાં વેરો ભરવાની જવાબદારી સમજાવો. (૧૪)

અથવા

પ્રશ્ન-૩ મૂલ્ય વર્ધિત વેરાના કાયદા નીચે મૂળ સ્થાનેથી કપાતો વર્ણવો.

પ્રશ્ન-૪ મૂલ્ય વર્ધિત વેરાના કાયદા નીચે હિસાબો રજુ કરવા અને માહિતી પૂરી પાડવાની જવાબદારી વિશે (૧૪)
 સમજાવો.

અથવા

પ્રશ્ન-૪ ગુનાઓ અને શિક્ષાઓ વિશે મૂલ્ય વર્ધિત વેરા નીચે ચર્ચા કરો.

પ્રશ્ન-૫ ટ્રંકનોંધ લખો (કોઈપણ બે) (૧૪)

(1) ખેતીની આવક.

અથવા

(1) આવકવેરા અધિકારી.

(2) ભરતીયાં

અથવા

(2) ફેરતપાસ.

English Version

Q-1 What is the income from house property? Describe the education permissible there to. (14)

OR

Q-1 Explain capital gain, computation and exemption particulars of capital assets under the head of income from capital gain.

Q-2 Explain assessment year, financial year and previous year with illustrations. (14)

OR

Q-2 Explain Income from salary and describe the deductions along with net income with example.

Q-3 Liability to pay tax in certain under value added tax. (14)

OR

Q-3 Explain deduction at source under value added tax.

Q-4 Explain under value added tax to represent accounts and particulars there to. (14)

OR

Q-4 Discuss offences and punishment under value added tax.

Q-5 Write short notes (Any Two): (14)

(1) Agricultural income.

OR

(1) Income Tax officer.

(2) Invoices.

OR

(2) Revision. (VAT)
